

મગજ સલેક થઈ ગયું હતું. તેમણે તરતે હેમલતાને કોણ ઓછો, ‘હેમલતા મારાથી ખૂલ થઈ ગઈ મને માફ કરી કે પણ્ણો... આચું કહું મેં ટેન્શનમાં તને ન કહેવાના શક્યો કરી દીધા સોરી થાર..’ હેમલતાને હસ્તીને જવાબ આપ્યો, ‘ચુંદી જાવ હવે, મને ખબર પડી ગઈ હતી તમારી શાસની રીતમાં જ તો કહેતી હતી. ગુણાંદિ, મળીએ... આવાણો..’

રોજબરોજના જીવનમાં પડકારજનક પરિસ્થિતિનો સામનો કરતી વખતે શરીર દ્વારા જે પ્રતિક્રિયા અપાય જે છે તથાપ - ટેન્શન, આજકાલ લોકોના મંજુસે બેલતો સૌથી વધારે શબ્દ, ૧૯૨૦ પહેલાં સ્ટ્રેસ શબ્દ ફિઝિક્સ (પદાર્થવિજ્ઞાન) માટે જ પ્રચલિત હતો. ૧૯૨૦થી ૧૯૩૦ના ગાળામાં ભયકારક પરિસ્થિતિમાં મગજને પડતું સ્ટ્રેઇન એવો શબ્દ ઉપયોગમાં લેવાતો થયો અને આજે તથાપ શબ્દથી દરેક વ્યક્તિ વાકેક છે. આપણા ઉપરના મગજનો આગળનો મંડ (ફિન્ટલ લોબ) વિચેક, બુદ્ધિ, ધૂતિ (કન્ટ્રોલ) અને સ્મૃતિનું સ્થાન છે. સ્વસ્થ અવસ્થામાં ચિંતા, કોષ, ભય વગેરે માનસિક ભાવ પર બુદ્ધિનો ડાબુ રહેલો છે. આ ભય ભાવો આપણા શરીરમાં થતી અનૈચ્છિક નાડીમંડળની ઉત્તેજના અધ્યાર્થી આવતા ખતરાથી અચાન્ક છે. સતર્કતા બસો છે, પરંતુ જ્યારે બુદ્ધિ સ્થાન નિર્ભર થઈ જાય અને માનસિક ભાવોનું સ્થાન પ્રબળ થાય ત્યારે ચિંતા, શોક, ભય વગેરે થોડીક જ વાર માટે રહેવાના બધું અનુભિત રૂપે નિરંતર રહ્યા કરે તો તે માનસિક રોગને જન્ય આપે છે.

તથાવના એ પ્રકાર પારી શકાય.

૧. હુકારાત્મક તણાવ

પરીક્ષા આપતો વખતે અનુભવાતો તથાપ તમને વિષય પ્રત્યે સર્તર્કતા અને છે, એકાથાતા આપે છે, પડકાર સાથે કરવાની શક્તિની આપે છે તે હુકારાત્મક છે.

એકિસિડન્ટ થતો ભયાવહા તમે જે બેંક મારો છો તે સર્તર્કતા વાલન ચલાવતી વખતે અનુભવાતી તથાને ચિંતાને છે.

હુકારાત્મક તથાપ તમને રસ્તા કરવા શક્તિની આપે છે, એલટ રાખે છે.

૨. નકારાત્મક તણાવ

નકારાત્મક તથાપ તમારી જીવનશૈલી, સંબંધો, ઉત્પાદકતા, મૂડ, સ્વસ્થ્ય પર વિપરીત અસરો કરે છે અને માનસિક વ્યાવિઘોને જન્ય આપે છે, જે ચિંતાપ્રથમાં માનસરોગ, વિભાગ્રધારણ માનસરોગ, ઉન્માદ્ગ્રધારણ માનસરોગ, વિદોરી વિચારપ્રુક્ત માનસરોગ છેવા રોગો પેઢા કરે છે જે વ્યક્તિનું વ્યક્તિત્વ જ બદલી નાખે છે.

તથાપ સમ્પે થતી શારીરિક ફેરફારો તમારી શક્તિની અને સ્ટેમીના રખાતી કે છે. તુંસું મર્ટિકસ શમતા વધારે છે, પરિસ્થિતિનો પડકાર કરવો કે ભય નિયાળી ભયાવ કરવો તે માટે સજ્જ બનાવે છે. તે સમ્પે મલિઝમાંથી સ્ટ્રેસ હોમ્યોન અવે છે અને એડિનાલ્બીનાનો સાવ થાય છે. તમે વાલન ચલાવતી વખતે થોડીક સાથે અથડાઈ જાવ તો શું થાય



**રોજબરોજના જીવનમાં
પડકારજનક પરિસ્થિતિનો
સામનો કરતી વખતે શરીર
દ્વારા જે પ્રતિક્રિયા અપાય
એ છે તણાવ - ટેન્શન.
આજકાલ લોકોના મોંએ
બોલતો સૌથી વધારે
શબ્દ, ૧૯૨૦ પહેલાં
સ્ટ્રેસ શબ્દ ફિઝિક્સ
(પદાર્થવિજ્ઞાન) માટે જ
પ્રચલિત હતો. ૧૯૨૦થી
૧૯૩૦ના ગાળામાં
ભયકારક પરિસ્થિતિમાં
મગજને પડતું સ્ટ્રેઇન
એવો શબ્દ ઉપયોગમાં
લેવાતો થયો અને આજે
તણાવ શબ્દથી દરેક
વ્યક્તિ વાકેક છે.**

છે... વિચારો. એ છે તથાપજનક પરિસ્થિતિમાં થનો શરીરીક ફેરફાર. આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ કુદી કુદી રીતે મનિક્રિયા આપે છે એમ કે કેટલીક વ્યક્તિનો ખૂબ ચુસ્તે થઈ જય છે, ઘણું વ્યક્તિનો ચૂપ થઈ જય છે, કેટલાક કોઈ પ્રતિબાધ જ નથી આપતા જે કેટલાક શૂન્યમનુસ્ક (હંડા-ફાગ) થઈ જય છે.

વધારે પડતા તણાવની ચેતવણી આપનાર લક્ષણો

- યાદશક્તિ ઓછી થવી.
 - એકાથાતા ઘટવી.
 - પરિસ્થિતિનો અસર કરવાની અક્ષમતા.
 - સતત ચિંતા કરવી.
 - તુંસું ચુસ્તે થવું.
 - ખૂશ ન હોવું.
 - વારંવાર મૂડ અફલાઈ જવો.
 - ઉચાટમાં જ રહેવું, જરાપણ રિલેક્સ થઈ ના શકવું.
 - એકલતા અનુભવવી અથવા એકલા રહેવા માંડવું.
 - ખૂબ વધારે જમવું અથવા ખૂબ ઓછું જમવું.
 - વધારે ઊંઘનું અથવા ઓછું ઊંઘનું.
 - બીજાથી પોતાને અલગ કરી લેવા.
 - જવાબદીથી દૂર ભાગવું.
 - નખ કરડાયા.
 - તમાકુ, લિગારેટ જેવી કુટેવો વધવી.
 - કાસેચામાં થાડો થવો.
 - વારંવાર શર્ટટો થઈ જવી.
 - છાતીમાં દુઃખવું, બળતરા થવી.
 - ઝડા થવા કે કબજીયાન થવી.
 - શરીરમાં ક્યાં ને ક્યાં દુઃખાયાની ફરિયાદ રહેવી.
 - બેલટી, ઉબકા જેવું થયા કરવું.
- આ ભય જ વતે-ઓછે અંશો એક કે વધારે લક્ષણોનો સમૂહ વધારે તાણ અનુભવતી વ્યક્તિનોમાં ઓછા મળે છે.

કેટલીક એવી જાબતો જે વ્યક્તિની તાણ સહન કરવાની શક્તિને મજબૂત કરે છે.

- પરિવારના લોકો તથા મિત્રોનો સપોર્ટ,